

Surah Yaseen in Gujarati

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી, જે અતિ કૃપાળુ અને દયાળુ છે.

1 یَسَّ

યાસીન.

2 وَالْقُرْآنِ الْحَكِيمِ

શપથ છે બુદ્ધિપૂર્ણ કુરઆનનો.

3 إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ

નિસંદેહ, તમે એક રાહનુમા પયગંબર છો.

4 عَلَى صِرَاطٍ مُسْتَقِيمٍ

સિદ્ધ માર્ગ પર.

5 تَنْزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ

એ મહાન અને દયાળુ અલ્લાહ તરફથી અવતરિત થયેલું છે.

6 لِنُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ

તમે તેને ડરાવવા માટે મોકલાયા છો, જેના પૂર્વજો ડરાવવામાં ન આવ્યા હતા, તેથી તેઓ ગફલત (અજ્ઞાન)માં છે.

7 لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ

ખરેખર, વધુતરફ લોકો પર (અલ્લાહનું) શબ્દ પૂરું થઈ ચૂક્યું છે, તેથી તેઓ ઈમાન લાવે નહીં.

إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُمْ مُقْمَحُونَ 8

અમે એમના ગળામાં બાંધણીઓ મૂકી દીધી છે જે એમના હોડાં સુધી છે, તેથી તેઓ ઉંચા મસ્તકવાળા બની ગયા છે.

وَجَعَلْنَا مِنْ بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ 9

અમે એમના આગળ અને પાછળ દીવાલો બનાવી છે અને એમની આંખોને ઢાંકી દીધી છે, તેથી તેઓ જોઈ શકતા નથી.

وَسَوَاءٌ عَلَيْهِمْ أُنذِرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ 10

તમે તેમને ચેતવશો કે નહિ, એમને કશું પણ ફરક પડતો નથી, તેઓ ઈમાન લાવશે નહીં.

إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَنَ بِالْغَيْبِ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ 11

તમે માત્ર તેને ચેતવી શકો છો જે સમરણ (ધર્મગ્રંથ)નું અનુસરણ કરે અને રહેમાન (અલ્લાહ)નો ભય રાખે, તેથી તેને ક્ષમા અને મહાન પુરસ્કારની શુભ ખબર આપો.

إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ وَكُلَّ شَيْءٍ 12
أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ

ખરેખર, અમે મરેલા જીવિત કરીએ છીએ અને જે તેઓ આગળ મોકલે છે અને જે પગલાં તેઓ છોડે છે, તે બધું અમે લખી રાખીએ છીએ. અને અમે દરેક વસ્તુને એક સ્પષ્ટ પુસ્તિકા (લિખાણ)માં ગણતરી કરી રાખી છે.

وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذِ جَاءَهَا الْمُرْسَلُونَ 13

અને તેમને ગામના લોકોનું ઉદાહરણ આપો જ્યારે એમને પયગંબર મોકલવામાં આવ્યા.

إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُم 14
مُرْسَلُونَ

જ્યારે અમે એમની તરફ બે (દૂત) મોકલ્યા, તો તેઓએ એમને ખોટા ઠેરવ્યા. તેથી અમે ત્રીજા (દૂત) દ્વારા એમને સમર્થન આપ્યું, અને તેઓએ કહ્યું: “ખરેખર, અમે તમારાથી મોકલાયેલા છીએ.”

قَالُوا مَا أَنْتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَمَا أَنْزَلَ الرَّحْمَنُ مِنْ شَيْءٍ إِنْ أَنْتُمْ 15
إِلَّا تَكْذِبُونَ

તેઓએ કહ્યું: “તમે ફક્ત અમારાં જેવા માણસો છો, અને રહેમાને કંઈ પણ અવતરિત કર્યું નથી. તમે માત્ર મિથ્યા બોલી રહ્યા છો.”

قَالُوا رَبَّنَا يَٰعَلَمُ إِنَّا إِلَيْكُم لَمُرْسَلُونَ 16

તેઓએ કહ્યું: “અમારા રબ જાણે છે કે ખરેખર અમે તમારાં તરફ મોકલાયેલા છીએ.”

وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ 17

અને અમારી ઉપર ફક્ત સ્પષ્ટ સંદેશ પહોંચાડવાનું (કર્તવ્ય) છે.

قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ ۗ لَئِن لَّمْ تَنْتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُم مِّنَّا 18
عَذَابٌ أَلِيمٌ

તેઓએ કહ્યું: “અમે તમારી હાજરીને અપશુકન ગણીએ છીએ. જો તમે બંધ નહીં કરો, તો અમે ચોક્કસ તમને પથ્થર મારી મારીશું અને અમારી તરફથી તમારે દુખદાયક શિષ્ટિ મળશે.”

قَالُوا طَائِرُكُم مَّعَكُمْ ۗ أَلَيْسَ ذُكْرُكُمْ ۚ بَلْ أَنْتُمْ قَوْمٌ مُّسْرِفُونَ 19

તેઓએ કહ્યું: “તમારું અપશુકન તમારાં સાથે છે! શું (તમે) ચેતવણી આપવામાં આવી તો (તે ખરાબ છે)? નહિ, તમે એક હદ કરતાં વટેલા લોકો છો.”

وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَى قَالَ يَا قَوْمِ اتَّبِعُوا 20

الْمُرْسَلِينَ

અને શહેરના અંત ભાગમાંથી એક માણસ દોડી આવ્યો. તેણે કહ્યું: “હે મારા લોકો, પયગંબરનો અનુસરણ કરો.”

اتَّبِعُوا مَنْ لَا يَسْأَلُكُمْ أَجْرًا وَهُمْ مُهْتَدُونَ 21

તમે તેનું અનુસરણ કરો જે તમને કોઈ મજૂરી માગતો નથી અને જે સીધા માર્ગ પર છે.

وَمَا لِي لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ 22

અને મને શું થયું છે કે હું તેનું પૂજન કરતો નથી, જેણે મને બનાવ્યો છે? અને તમારે પણ તેની તરફ પાછા ફરવું છે.

أَتَّخِذُ مِنْ دُونِهِ آلِهَةً إِنْ يُرِدْنِ الرَّحْمَنُ بِضُرٍّ لَا تُغْنِ عَنِّي 23
شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنْقِذُونَ

શું હું તેને છોડીને અન્ય દેવતાઓને રાખીશ? જો રહેમાન મને નુકસાન પહોંચાડવા ઇચ્છે, તો તેમની શિફારસ મને કોઈ ફાયદો નહીં આપે અને તેઓ મને બચાવી પણ નહીં શકે.

إِنِّي إِذَا لَفِي ضَلَالٍ مُّبِينٍ 24

જો હું આવું કરું, તો હું ચોક્કસ સ્પષ્ટ ગુમરાહીમાં રહું.

إِنِّي آمَنْتُ بِرَبِّكُمْ فَاسْمَعُونَ 25

ખરેખર, હું તમારા રબ પર ઇમાન લાવ્યો છું, તો તમે (મારી વાત) સાંભળો.

قِيلَ ادْخُلِ الْجَنَّةَ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ 26

કહ્યું ગયું: “જન્નતમાં દાખલ થઈ જાઓ!” તે કહે: “હાય, કાશ, મારા લોકો જાણતા!”

بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ 27

કે મારા રબે મને ક્ષમા કરી અને મને સન્માનિત કરેલા લોકોમાં સામેલ કર્યો.

وَمَا أَنْزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِنْ بَعْدِهِ مِنْ جُنْدٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنْزِلِينَ 28

અને અમે તેના પછી તેના લોકોને આસમાને કોઈ લશ્કર મોકલ્યું નહીં અને અમે એવા મોકલનારા પણ નહોતાં.

إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ 29

તે ફક્ત એક જ ગર્જના હતી, અને પછી તેઓ બુઝાઈ ગયેલા (નિર્વાણ) થઈ ગયા.

يَا حَسْرَةً عَلَى الْعِبَادِ مَا يَأْتِيهِمْ مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ 30

હાય, આ બંદાઓ માટે શોક છે! તેઓ પાસે જે પણ દૂત આવ્યો, તેઓએ તેની ઉપેક્ષા કરી અને મજાક ઉડાવ્યું.

أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِّنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ 31

શું તેઓએ નથી જોયું કે અમે કેટલા પિળા લોકોને નષ્ટ કર્યા છે, જે હવે તેમની તરફ પાછા ફરતા નથી?

وَإِنْ كُلُّ لَمَّا جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ 32

અને તેઓ તમામ (એક દિવસ) અમારી સામે હાજર કરવામાં આવશે.

وَآيَةٌ لَهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ 33

અને તેઓ માટે નિશાની મૃત જમીન છે, જેને અમે જીવંત બનાવી, અને તેનામાંથી અનાજ કાઢ્યું, જેનો તેઓ ઉછેર કરે છે.

وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّنْ نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجْرْنَا فِيهَا مِنَ الْعُيُونِ 34

અને અમે તેમાં ખજૂર અને દ્રાક્ષના બાગ બનાવ્યા અને તેમાં ઝરણાઓ વહાવ્યા.

لِيَأْكُلُوا مِنْ ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ أَفَلَا يَشْكُرُونَ 35

તેમણે તેના ફળ ખાધાં અને જે તેમને તેમના હાથે બનાવ્યું તે પણ, તો શું તેઓ આભાર માનતા નથી?

سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنْبِتُ الْأَرْضُ وَمِنْ أَنْفُسِهِمْ 36
وَمِمَّا لَا يَعْلَمُونَ

પવિત્ર છે તે જેણે દરેક વસ્તુને જોડીમાં બનાવ્યું – તેમાંથી જે જમીન ઉગાડે છે, અને પોતે, અને જે તેઓ જાણતા નથી.

وَآيَةٌ لَهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُمْ مُظْلِمُونَ 37

અને રાત (એક નિશાની છે) કે અમે તેમાંથી દિવસ ખેંચી લઈએ છીએ, પછી તેઓ અંધકારમાં છવાઈ જાય છે.

وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَّهَا ۚ ذَلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ 38

અને સૂર્ય, જે તેના નિર્ધારિત ગતિમાં દોડે છે – આ મહાન શક્તિશાળી અને સર્વજ્ઞાનીનો નિર્ધાર છે.

وَالْقَمَرَ قَدَرْنَا مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ 39

અને ચંદ્ર માટે પણ અમે નિર્ધારિત સ્તરો રાખ્યાં છે, જ્યાં સુધી તે જૂના સુકાયેલા ખજૂરના શંખ જેવા ન થઈ જાય.

لَا الشَّمْسُ يَنْبَغِي لَهَا أَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ 40
وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ

સૂર્યને ચંદ્રને પકડવાની શક્યતા નથી, અને ન રાત દિવસને ઓવરટેક કરી શકે છે; અને દરેક પોતાની કક્ષામાં ગતિશીલ છે.

41 **وَآيَةٌ لَهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلِكِ الْمَشْحُونِ**

અને તેઓ માટે (એક) નિશાની એ છે કે અમે તેમની સંતતિને ભરેલી નૌકામાં ચઢાવી.

42 **وَخَلَقْنَا لَهُمْ مِنْ مِثْلِهِ مَا يَرْكَبُونَ**

અને અમે તેમના માટે તે જેવી બીજી વસ્તુઓ બનાવી, જે પર તેઓ સવાર થાય છે.

43 **وَإِنْ نَشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ**

અને જો અમે ઈચ્છીએ, તો અમે તેમને ડૂબાડી શકીએ, અને પછી કોઈયે તેમને બચાવી શકશે નહીં, કે તેઓ છૂટકારો મેળવી શકે.

44 **إِلَّا رَحْمَةً مِنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ**

પરંતુ અમારી દયા અને નિર્ધારિત સમય સુધીની સુખસગવડ માટે.

45 **وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ**

અને જ્યારે તેમને કહેવામાં આવે કે “તમારા આગળ અને પાછળના (કર્મો) નો ભય રાખો, કદાચ તમને દયા મળશે,”

46 **وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ**

તેમના રબની કોઈ નિશાની તેમની પાસે આવે, તો પણ તેઓ તે તરફથી મોં ફેરવી લે છે.

47 **وَإِذَا قِيلَ لَهُمْ أَنْفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا**

أَنْطِعِم مَن لَّو يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنْتُمْ إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ

અને જ્યારે તેઓને કહેવામાં આવે કે “તમે જે અલ્લાહે આપ્યું છે તેમાંથી દાન કરો,” તો કાફિર મુમિનોને કહે: “શું અમે તેને ખવડાવશું, જેણે જો ઈચ્છ્યું હોત તો પોતે જ તેને આપી શક્યો હોત?” તમે તો માત્ર સ્પષ્ટ ભ્રમમાં છો.

48 وَيَقُولُونَ مَتَىٰ هٰذَا الْوَعْدُ إِن كُنْتُمْ صَادِقِينَ

અને તેઓ કહે: “આ વચન ક્યારે સાકાર થશે, જો તમે સાચા હશો?”

49 مَا يَنْظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ

તેઓ ફક્ત એક જ જોરદાર અવાજની રાહ જોઈ રહ્યા છે, જે તેમને પકડી લેશે, જ્યારે તેઓ વાદવિવાદમાં રહેલા હશે.

50 فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ

ત્યારે તેઓ وصیت (વારસો આપવા) પણ શકશે નહીં, અને તેઓ તેમના કુટુંબ તરફ પાછા પણ જઈ શકશે નહીં.

51 وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُمْ مِنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنْسِلُونَ

અને જ્યારે સૂર ફૂંકવામાં આવશે, ત્યારે તેઓ કબરમાંથી નીકળીને તેમના રબ તરફ દોડી જશે.

52 قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۗ هٰذَا مَا وَعَدَ الرَّحْمٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ

તેઓ કહેશે: “હાય અમારું દુ:ખ! અમને કોણ અમારી નિંદ્રાથી ઉઠાવી ગયું?” (તેમને કહેવામાં આવશે:) “આ તો એ છે જે રહમાનને વચન આપ્યું હતું, અને રસૂલો (દૂતો) સાચા હતા.”

53 إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ

એ માત્ર એક જ જોરદાર અવાજ હશે, અને તે પછી તેઓ સર્વે અમારી હાજરીમાં હશે.

فَالْيَوْمَ لَا تُظَلِّمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنْتُمْ تَعْمَلُونَ 54

આજે કોઈ પણ આત્મા પર કોઈ અણ્યાય નહીં કરવામાં આવે, અને તમારે ફક્ત તમારા કરેલા કાર્યોનું પુરસ્કાર મળશે.

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغْلٍ فَاكِهِونَ 55

જન્નતના વાસીઓ આજે આનંદમાં હશે, મસ્તીમાં મગ્ન હશે.

هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَكِينُونَ 56

તેઓ અને તેમની પત્નીઓ છાયામાં રહેલા હશે, સોફાઓ પર આરામથી બેસેલા હશે.

لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُمْ مَا يَدَّعُونَ 57

તેમને ત્યાં પ્રચુર ફળો હશે, અને જે કંઈ તેઓ ઈચ્છશે તે મળશે.

سَلَامٌ قَوْلًا مِّن رَّبِّ رَحِيمٍ 58

તેમને કૃપાળુ રબ તરફથી શાંતિનો સંદેશ મળશે.

وَأَمَّا تَزُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ 59

અને (કહેવાશે:) “અરે ગુનાહિતો! આજે (સાચા મોમિનોથી) અલગ થઈ જાઓ!”

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَنْ لَا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ 60

હે આદમના સંતાન! શું મેં તમને વચન ન આપ્યું હતું કે શેતાનની ઈબાદત ન કરશો? ખરેખર, તે તમારો ખુલ્લો દુશ્મન છે!

وَأَنْ اعْبُدُونِي ۚ هَذَا صِرَاطٌ مُسْتَقِيمٌ 61

અને મારી જ ઈબાદત કરો, આ સીધો માર્ગ છે.

وَلَقَدْ أَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِيرًا أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ 62

અને ચોક્કસપણે શેતાને તમારામાંથી ઘણાં બધાને ભટકાવી દીધા. શું તમે સમજી ન શક્યા?

هَذِهِ جَهَنَّمُ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ 63

આ જહન્નમ છે જેનો તમારો વાયદો કરવામાં આવ્યો હતો.

اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ 64

આજે તમે તમારા કફુર (અવિશ્વાસ)ના બદલામાં તેમાં પ્રવેશ કરો.

الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُمْ بِمَا كَانُوا يَكْسِبُونَ 65

આજે અમે તેમના મોઢાં પર મોહર મારીશું, અને તેમના હાથ અમને વાત કરશે અને તેમના પગ તેમના કરેલા કાર્યોની ગવાહી આપશે.

وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّىٰ يُبْصِرُونَ 66

જો અમે ઇચ્છીએ, તો અમે તેમની આંખોને અંધ કરી નાખી શકીએ, જેથી તેઓ માર્ગની શોધમાં દોડી પણ શકે નહીં.

وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا وَلَا يَرْجِعُونَ 67

જો અમે ઇચ્છીએ, તો અમે તેમને તેમની જગ્યાએ જ રૂપાંતરિત કરી શકીએ, જેથી તેઓ આગળ પણ ન વધી શકે અને પાછા પણ ન ફરી શકે.

وَمَنْ نُعَمِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ أَفَلَا يَعْقِلُونَ 68

અને જેને અમે લાંબી ઉમર આપીએ, તેને અમે (શારિરીક રીતે) કમજોર કરી દઈએ. તો શું તેઓ સમજે નહીં?

69 وَمَا عَلَّمْنَاهُ الشُّعْرَ وَمَا يَنْبَغِي لَهُ ^ع إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ مُّبِينٌ

અને અમે (નબીને) શાયરી શીખવી ન હતી, ન તો તે તેમને યોગ્ય હતી. આ તો ફક્ત એક ઉપદેશ છે અને સ્પષ્ટ કુરાન છે.

70 لِيُنذِرَ مَنْ كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكَافِرِينَ

તાકિ તે (કુરાન) જીવંત લોકો માટે ચેતવણી બની રહે અને કાફિરો પર (અલ્લાહનો) વચન પૂરું થઈ જાય.

71 أَوْلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُمْ مِمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا مَالِكُونَ

શું તેઓ નથી જુએ કે અમે તેમના માટે અમારા હાથે બનાવેલા પશુઓ પેદા કર્યા છે, તેથી તેઓ તેના માલિક છે?

72 وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ

અને અમે તેને તેમ માટે વશ કરી દીધા, તેમાથી તેઓ સવારી કરે છે અને તેમાથી ખાય છે.

73 وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبٌ ^ط أَفَلَا يَشْكُرُونَ

અને તેમાં તેઓ માટે લાભો અને પીવાની વસ્તુઓ છે. તો શું તેઓ આભાર માને નહીં?

74 وَاتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنصَرُونَ

અને તેમણે અલ્લાહ સિવાય બીજા દેવો બનાવી લીધા, આશા રાખતા કે તેઓની મદદ થશે.

75 لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُنْدٌ مُّحْضَرُونَ

પરંતુ તે (દેવતાઓ) તેમની મદદ કરી શકતા નથી, તેઓ તો પોતે જ તેમના માટે લાવેલા સૈનિકો છે.

فَلَا يَحْزَنُكَ قَوْلُهُمْ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ 76

તેમના વચનો તને દુઃખી ન કરે. ખરેખર, અમે જાણીએ છીએ કે તેઓ શું છુપાવે છે અને શું જાહેર કરે છે.

أَوَلَمْ يَرَ الْإِنْسَانُ أَنَا خَلَقْنَاهُ مِنْ نُطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُبِينٌ 77

શું મનુષ્યએ નથી જોયું કે અમે તેને બુંદ (વીર્ય)માંથી બનાવ્યો છે? છતાં તે ખુલ્લો વિવાદકર્તા બની જાય છે.

وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۗ قَالَ مَنْ يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ 78

અને તેણે અમારું ઉદાહરણ આપ્યું અને પોતાની સર્જનાને ભુલી ગયો. તેણે કહ્યું, ‘આ હાડકાંઓ જીવંત કોણ કરશે જ્યારે તે સૂકા થઈ જશે?’

قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۗ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ 79

કહો, ‘તેને જીવન તે આપશે, જેણે પ્રથમ વખત તેને સર્જ્યા છે. અને તે દરેક સર્જન વિશે પરિપૂર્ણ જાણે છે.’

الَّذِي جَعَلَ لَكُم مِّنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنْتُمْ مِّنْهُ تُوقِدُونَ 80

જે તમને લીલા વૃક્ષમાંથી અગ્નિ પેદા કરીને આપે છે, અને તમે તેમાં આગ પ્રગટાવો છો.

أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِقَادِرٍ عَلَىٰ أَنْ يَخْلُقَ 81

مِثْلَهُمْ ۗ بَلَىٰ ۗ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ

શું જે શામાન અને ધરતીનું સર્જન કરી શકે છે, તે તેમની જેમ (ફરીથી) સર્જી શકતો નથી? હા, ખરેખર! અને તે સર્વશક્તિમાન સર્જનહાર છે.

إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ 82

જ્યારે તે કંઈક ઇચ્છે છે, ત્યારે તે ફક્ત કહે છે: ‘હો’ અને તે થઈ જાય છે.

83 فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَإِلَيْهِ تُرْجَعُونَ

તો પવિત્ર છે તે જેની હાથમાં દરેક વસ્તુનું શાસન છે, અને તેની તરફ જ તમે પરત ફરશો.